

# આઈઆઈટી ગાંધીનગર દ્વારા મેન્ટર કોન્કલેવનું આયોજન

નવગુજરાત સમય > અમદાવાદ

■ શાળામાં અભ્યાસ કરતાં બાળકો તેમની કારકીર્દી ઘડતર બાબતે વહેલી તકે નિર્ણય લઈ શકે તે હેતુથી બાળકોને મદદરૂપ થવા માટે આઈઆઈટી ગાંધીનગર દ્વારા મેન્ટર કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું છે. આ કોન્કલેવમાં વિવિધ ક્ષેત્રની જાણીતી હસ્તીઓ દ્વારા ધોરણ ૯ થી ૧૨ના વિદ્યાર્થીઓનું માર્ગદર્શન કરવામાં આવશે.

વિદ્યાર્થીઓને આ હસ્તીઓ સાથે વાતચીત કરવાની અને તેમના

અનુભવોમાંથી શીખવાની તક મળશે. ૨૩ જુલાઈ શનિવારે આઈઆઈટી ગાંધીનગર ખાતે આ મેન્ટર કોન્કલેવ યોજાશે. કેન્ટોન્મેન્ટ અને સીઆરપીએફની કેન્દ્રિય વિદ્યાલયના લગભગ ૨૦૦ બાળકોએ તેમાં રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

શનિવારે સવારે ૯થી ૧ દરમિયાન યોજનારા આ કોન્કલેવમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના ચેસ પ્લેયર ધ્યાનિ દવે, લવ ફોર સેલેડના ઓનર વિદ્યા રાણા, તેમજ ગ્લેડ એંગેજ સ્ટાર્ટ અપના કુશાગ્ર ભાર્ગવ સહિતના લોકો વિવિધ સેશન્સ લેશે.